

### આ પ્રકરણમાં તમે શું શીખશો ?

- પ્રસ્તાવના
- 6.1 દોરવણીનો અર્થ
  - 6.1.1 લાક્ષણિકતાઓ
  - 6.1.2 મહત્વ
- 6.2 દોરવણીનાં તત્વો
  - 6.2.1 નિરીક્ષણ
  - 6.2.2 નિરીક્ષકનાં કાર્યો
- 6.3 અભિપ્રેરણ
  - 6.3.1 અર્થ
  - 6.3.2 લાક્ષણિકતાઓ
  - 6.3.3 માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાકમ
- 6.4 નાણાકીય અને બિનનાણાકીય પ્રોત્સાહનો
  - 6.4.1 નાણાકીય પ્રોત્સાહનો
  - 6.4.2 બિનનાણાકીય પ્રોત્સાહનો
- 6.5 નેતૃત્વ
  - 6.5.1 અર્થ
  - 6.5.2 લાક્ષણિકતાઓ
  - 6.5.3 સારા નેતાના ગુણો
- 6.6 માહિતીસંચાર
  - 6.6.1 અર્થ
  - 6.6.2 લાક્ષણિકતાઓ
  - 6.6.3 વૈધિક અને અવैધિક માહિતીસંચાર
  - 6.6.4 વૈધિક અને અવैધિક માહિતીસંચાર વચ્ચેનો તફાવત
  - 6.6.5 અસરકારક માહિતીસંચારના અવરોધો
  - 6.6.6 અવરોધો દૂર કરવાના ઉપાયો

### પ્રસ્તાવના (Introduction)

સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. દોરવણી, આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે. ધંધાકીય એકમનું ઘેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્રમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી આપનાર સક્રમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે. તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્રમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. આમ, સક્રમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે.

ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં બૂધરચનાઓ ઘડવાનાં કાર્યો જેવું છે. તેમાં સાધન-સામગ્રી અને માનવ શક્તિઓના ઉપયોગો, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેનાં સ્થાનો, અર્થતંત્રની ગુંચવણાભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ થાય છે.

#### 6.1 અર્થ (Meaning)

સામાન્ય અર્થમાં ‘દોરવણી’ એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો.’

- ‘કર્મચારીઓને ઘેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી.’

- કુન્તા અને ઓ’ડોનેલના જણાવ્યા મુજબ, ‘તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી.’

- દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે.

#### 6.1.1 લાક્ષણિકતાઓ (Characteristics) :

- (1) હેતુલક્ષી પ્રવૃત્તિ : દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ઘેયસિદ્ધ થઈ શકે છે. આમ, દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે.

(2) સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય : દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે અને જોબર, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ, ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે.

(3) સતત ચાલતી પ્રક્રિયા : ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે તાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. કાર્ય, કાર્યવિધી તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે. જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે.

(4) કાર્યો પર દેખરેખ : દોરવણી આપવાનો ઉદેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહિ તે જોવાનો છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહિ તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે.

(5) વિશાળ કાર્યક્ષેત્ર : દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે.

(6) માહિતીસંચાર : દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતીસંચારની પૂર્વશરત ગણાય છે. જો માહિતીસંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે, યોગ્ય કર્મચારીને, યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય.

(7) પ્રોત્સાહન : કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે, તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે.

(8) નિભન્નગમી પ્રવૃત્તિ : દોરવણી એ નિભન્નગમી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે.

(9) સંચાલકીય કાર્ય : સંચાલનનાં વિવિધ કાર્યો જેવાં કે, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતીપ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે.

### 6.1.2 મહત્વ (Importance) :

ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનાં કાર્યોનું નિરીક્ષણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધેય હાંસલ કરી શકાય છે. સંચાલન પ્રક્રિયાનાં વિવિધ કાર્યો પૈકી દોરવણીનું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

(1) કાર્યક્ષમતામાં વધારો : વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

(2) કાર્યક્ષમતાનું વિશ્વેષણ : દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્વેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહિ, કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે. તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્વેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે.

(3) કર્મચારીઓને પ્રોત્સાહન : દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ તથા નીતિ-નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધાઓ દૂર કરી શકાય છે જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે.

(4) અસરકારક આયોજન : ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને આયોજન ઘડે છે. આયોજન દ્વારા નિર્ધારીત કરેલા ધેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે.

(5) અસરકારક વ્યવસ્થાતંત્ર : દોરવણીને કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો જ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થાતંત્ર અસરકારક બને છે.


(6) સંકલન અને સહકાર : દોરવણી દ્વારા કર્મચારીઓનાં કાર્યોનું સંકલન સાથી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોનાં કાર્યોનું સંકલન કરે છે.

(7) અંકુશનું કાર્ય : દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. તેથી નિર્ધારીત લક્ષણો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બને છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે.

(8) કાર્યજુસ્સામાં વધારો : દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે. રૂચિ વધે છે. જ્યારે કોઈ અવરોધો ઉભા થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. પરિણામે કાર્યનું સાતત્ય વધે છે જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે.

(9) વિચલનોની શોધ : નિર્ધારીત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે જેથી અનિયધનીય વિચલનોને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. પ્રાથમિક તબક્કાનાં વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે.

## 6.2 દોરવણીનાં તત્ત્વો (Elements of Directing)



### 6.2.1 નિરીક્ષણ (Supervision) :

કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટાભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનનાં કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનનાં કાર્ય અંગે જવાબદાર હોય છે. તે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

નિરીક્ષણ એટલે તાબેદારોને સૌંપવામાં આવેલ કાર્યોનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી, ધંધાકીય એકમના ધ્યોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભौતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી.

**અર્થ :**

- સરળ અર્થમાં કહી શકાય કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.
- આર. સી. ટેવીસના જણાવ્યા મુજબ, ‘નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે.’

### 6.2.2 નિરીક્ષકનાં કાર્યો (Functions of Supervisor) :

- (1) કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા.
- (2) કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી.
- (3) કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે.
- (4) કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે.
- (5) કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરાં પાડે છે.
- (6) કર્મચારીઓમાં જૂથભાવના ટકાવી રાખે છે.
- (7) માહિતીસંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે.
- (8) એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિખ્યક માર્ગદર્શન આપે છે.
- (9) કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે.
- (10) નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે.
- (11) નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. (Friend, Philosopher and Guide)

### 6.3 અભિપ્રેરણ (Motivation)

અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલાં બધાં જ સાધનોમાં માનવી જ એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. માનવી એક જીવંત સાધન છે. તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂજ હોય છે. જેથી કાર્યપ્રેરણા આપવી જરૂરી હોય છે.

અભિપ્રેરણ એ એક વિસ્તૃત ઘ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, બિનનાડાકીય પ્રોત્સાહનો, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે.

**6.3.1 અર્થ (Meaning) :** સામાન્ય અર્થમાં, ‘કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગ્ગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણા.’

● જુસીઅસના જણાવ્યા મુજબ, ‘ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે.’

● મોર્ગનના જણાવ્યા મુજબ, ‘અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી થાય છે.’

આમ, અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.

#### 6.3.2 લાક્ષણિકતાઓ (Characteristics) :

(1) આંતરિક પ્રેરણા : અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભબવે છે. જરૂરિયાત એવી લાગણી છે, જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે.

(2) મનોવૈજ્ઞાનિક ઘ્યાલ : અભિપ્રેરણનો ઘ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ઘ્યાલો જુદા જુદા હોય છે. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે.

(3) કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે, તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. જેથી એકમની નફકારકતા વધે છે.

(4) સતત પ્રક્રિયા : અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે. તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી ન શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે.

(5) ફેરબદ્ધી દરમાં ઘટાડો : અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે જેથી મજૂર ફેરબદ્ધી દરમાં ઘટાડો થાય છે.

(6) ઉદ્દેશોની પ્રાપ્તિ : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે.

(7) વિસ્તૃત ક્ષેત્ર : અભિપ્રેરણ ઘ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રવોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે.

(8) પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ : આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થાતંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આવાં પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલસામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતાં રહે છે. આવાં પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતાં નથી પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવાં પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે.


(9) સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન : કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્યસંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે.

(10) હકારાત્મક અભિગમ : અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થાતંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી

અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીનો અને એકમનો વિકાસ શક્ય બને છે જે હકારાત્મક અભિગમનું પરિણામ છે.

(11) સંચાલનનું એક કાર્ય : અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકોએ ભौતિક સાધનો પાસેથી નહીં, પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે.

**6.3.3 માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાકમ (Hierarchy of needs by Maslow) :** માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. જરૂરિયાતો સંતોષાવાથી માનવી અભિપ્રેરિત થાય છે. આવી જરૂરિયાતોને કમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અભ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાકમનો સિદ્ધાંત 1943માં ‘માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત’ એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો. આવી પાંચ જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાકમમાં રજૂ કરી છે.



(1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો : શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાકમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાય નહીં તાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્વ આપતો નથી.

(2) સલામતીની જરૂરિયાતો : શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતાકમની દર્દીએ સલામતીની જરૂરિયાત આવે છે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોગમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવાં કાર્યો કરે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી બને છે.

(3) સામાજિક જરૂરિયાતો : જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પણી સામાજિક જરૂરિયાતોનો કમ આવે છે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગાસંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશાં ઈચ્છાઓ હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા મિત્રો, સગાસંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત તે અનુભવે છે.

(4) સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો : ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારીઓ કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની જંખના વધે છે. ટૂંકમાં, સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતો આ કમમાં આવે છે.


(5) આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો : માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશાં સિદ્ધિનાં શિખરો સર કરી યોય ઉપર બિરાજવા ઈચ્છાતી હોય છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીષ્ટાનાં મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. દા.ત., તબલા વાદનમાં જાડીર હુસેન, સંતુર વાદનમાં શીવકુમાર શર્મા, કિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, સંગીતક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે.

#### 6.4 નાણાકીય અને બિનનાણાકીય પ્રોત્સાહનો (Financial and Non-Financial Incentives)

**પ્રોત્સાહનો (Incentives) :** કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરૂચિ જગ્યાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણ પૂરી પાડે છે. આ પ્રેરણને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે.

Incentive means which incites or has a tendency to incite action. - પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે.

પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે. કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. પ્રોત્સાહનોના બે પ્રકાર છે.



##### 6.4.1 નાણાકીય પ્રોત્સાહનો (Financial Incentives) :

નાણાકીય પ્રોત્સાહનો આવડત અને ફુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનોથી તેમના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોબો વધે છે. પ્રગતિશીલ અને વ્યાવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના એકમમાં કાર્યરત કર્મચારીઓ કે કામદારોને નીચે મુજબની વિવિધ રીતોમાંથી કોઈપણ રીતે નાણાકીય પ્રોત્સાહનો પૂરાં પાડતા હોય છે.

(1) **નફામાં ભાગ :** એકમને મળતો અધિક નફો (Surplus Profit) એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ, કામદારોને નાણા સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને નફાભાગ કહે છે.

(2) **સહભાગીદારી :** કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે. કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદનવૃત્તિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે.

(3) **બઢતી :** કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. જેથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. બઢતીને કારણે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે.

(4) **બોનસ :** વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનું પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષ ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે.

(5) **કમિશન :** એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે અલગ-અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ-અલગ કમિશન દર નક્કી કરે છે. વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે.

(6) **ઈનામો :** એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને

તેની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્રક આપી જહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સા, ધગશ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.

(7) સલાહ અને સૂચનો : કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે. જે સૂચનો ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય છે. આવી સલાહ અને સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે.

#### 6.4.2 બિન-નાણાકીય પ્રોત્સાહનો (Non-Financial Incentives) :

જે પ્રોત્સાહનો નાણા આધારીત હોતાં નથી તેવાં પ્રોત્સાહનોને બિનનાણાકીય પ્રોત્સાહનો કહે છે. બિનનાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે.

(1) નોકરીની સલામતી : કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે. નોકરીની સલામતી મળવાથી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે.

(2) કામની કદર અને સન્માન : જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જહેરમાં સન્માન કરવામાં આવે છે, જેથી આવા કર્મચારીઓ તો પ્રોત્સાહિત થાય છે પરંતુ અન્ય કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે.

(3) જવાબદારીની સોંપણી : કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

(4) સલાહકાર : જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ લેવા કાર્યસંબંધી નીતિ ઘડવામાં તેમનાં મંતવ્યો લેવામાં આવે છે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે.

(5) કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ : કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી સુવિધાઓ પણ કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે, કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સર્સ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમ્યાન તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓનો લાભ આપે છે. તેનાથી કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે.

(6) અન્ય પ્રોત્સાહનો : ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજાં અન્ય પ્રકારનાં પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તકો, ધરેથી ધંધાકીય એકમ સુધી આવવા-જવાની વાહન સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.

#### 6.5 નેતૃત્વ (Leadership)

જ્યાં વ્યક્તિઓનું જૂથ હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભબે છે. ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કામ કરે છે. આ જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ દ્વારા વ્યવસ્થાતંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થાતંત્રનું માળખું ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની આધારશીલા છે. નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. નિર્ધારિત ધ્યેય, લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરાં પાડે છે. આથી નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણાસ્કોત છે.

**6.5.1 અર્થ (Meaning) :** કોઈપણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપાયવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કરી શકાય.

- અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ.

● ડૉ. જ્યોર્જ આર. ટેરીના જણાવ્યા મુજબ ‘નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે.’

ઉપરોક્ત વાણ્યાઓને આધારે સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે જે કોઈપણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. આ આવડતને નેતૃત્વ કે નેતાગીરી તરીકે ઓળખવામાં આવે છે.

### 6.5.2 લાક્ષણીકતાઓ (Characterstics) :

- (1) તાબેદારોનું અસ્તિત્વ : નેતા હંમેશાં તાબેદારોને નેતૃત્વ પૂરું પડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે.
- (2) સતત પ્રક્રિયા : જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે.
- (3) નેતૃત્વનો સ્વીકાર : નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો તેને અનુસરે છે.
- (4) અવैધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો : નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવैધિક રીતે પડ્યા તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરે છે.
- (5) આદર્શ વ્યક્તિત્વ : નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણુકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. નેતામાં અમુક જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. આવી શુણસભાર વ્યક્તિ જ નેતાગીરી કરી શકે છે.
- (6) અભિપ્રેરણા : નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઇચ્છિત પરિણામો મેળવે છે.
- (7) હિતોની એકવાક્યતા : નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એકવાક્યતા સધાય છે. જો નેતા અને તેના તાબેદારોનાં હિતો અલગ-અલગ હોય તો નેતૃત્વ બિન-અસરકારક અને નિરથક નિવઢે છે.
- (8) પરિસ્થિતિઓની અસર : નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફરજાર થાય તો નેતાને સફળતા મળતી નથી.

### 6.5.3 સારા નેતાના ગુણો (Qualities of a Good Leader) :

- (1) શારીરિક ગુણો : એક પ્રભાવશાળી નેતા માટે સારી શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોને કાર્યપ્રેરણા આપે છે.
- (2) બૌદ્ધિક ગુણો : સારો નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણોમાં નિર્ણયશક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણશક્તિ, વૈજ્ઞાનિક દાખિલોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્કશક્તિ, દીર્ઘદાટિ તથા વિવિધ કૌશલ્યો જેવાં કે વક્તૃત્વ કળા, ગણન કૌશલ્યો, આંતરસંબંધોનું જ્ઞાન તથા માનવીય કૌશલ્યો વગેરેનો સમાવેશ થાય છે.
- (3) માનસિક ગુણો : મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બૃદ્ધિચાતુર્ય, કાર્યરૂપી લાગણી તથા વિવેકવર્તનનો સમાવેશ થાય છે.

### 6.6 માહિતીસંચાર (Communication)

માહિતીસંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ વિજ્ઞાન અને માહિતીસંચારના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. આ ક્ષેત્રની પ્રગતિના કારણે વિશ્વના તમામ દેશો એકબીજાથી ખૂબ જ નજીક આવી રહ્યા છે. વ્યાપારિક દાખિલે જોઈએ તો સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. માહિતીસંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંત્ર્યો વગેરેની આપ-લે કરવાની પ્રક્રિયા છે. એકમના વિવિધ વિભાગોની માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. તે માટે તળ સપાટીથી કેટલીક માહિતી ઉપરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતીપ્રેષણ. જ્યારે માહિતીસંચારમાં હુકમો અને આદેશો આપવા, અહેવાલ મેળવવા, ફરિયાદો સાંભળવી અને તેનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. માહિતીસંચાર માટે માહિતીપ્રેષણ અનિવાર્ય છે.

#### 6.6.1 અર્થ (Meaning) :

એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકંબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશોને સમજી શકે અને તેનો અમલ કરી શકે.

● માહિતીસંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંત્ર્યોના આદાન-પ્રાદન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે.

● ન્યુમેન એન્ડ સમરના જણાવ્યા મુજબ, ‘માહિતીસંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓની બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે.’

### 6.6.2 લાક્ષણીકતાઓ (Characteristics) :

- (1) હેતુલક્ષી પ્રક્રિયા : માહિતીસંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી પરંતુ તે દ્વારા ઔદ્ઘોગિક એકમના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાનો છે તેથી જે વ્યક્તિને માહિતી આપવામાં આવે તે વ્યક્તિ સંદેશાને સમજે છે કે નહિ તેની ખાસ તક્કેદારી રાખવામાં આવે છે.
- (2) શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ : માહિતીસંચારમાં જે શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવાં જોઈએ. દ્વિઅર્થી ન હોવાં જોઈએ.
- (3) દ્વિમાર્ગી પ્રક્રિયા : માહિતીસંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. ઉચ્ચ સંચાલકો હેતુ, નીતિ, વિધિ, પદ્ધતિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે જ્યારે મધ્ય અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે છે.
- (4) કાયમી પ્રક્રિયા : માહિતીસંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. એકમના ઉદ્દ્દ્વબની સાથે જ માહિતીસંચારની પ્રવૃત્તિ શરૂ થાય છે અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે જે એકમના અંત સુધી ચાલે છે.
- (5) અસંખ્ય સાધનો : આધુનિક સમયમાં માહિતીસંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઇલ ફોન, એસ.એમ.એસ., ટેલેક્ષ વગેરેનો ઉપયોગ થાય છે.
- (6) અનેક પ્રકારો અને પદ્ધતિઓ : માહિતીસંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે જેવી કે આંતરિક માહિતીસંચાર, બાહ્ય માહિતીસંચાર, લેખિત માહિતીસંચાર, મૌખિક માહિતીસંચાર અને ઈશારા દ્વારા માહિતીસંચારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.
- (7) કાર્યપ્રેરક પ્રવૃત્તિ : માહિતીસંચારની પ્રવૃત્તિને કારણો અધિકારીઓમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામે તેમને કાર્ય કરવાની પ્રેરણા મળે છે.
- (8) વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ : માહિતીસંચાર એ મુજબત્વે એકમના વહીવટ સાથે સંબંધ ધરાવે છે. અસરકારક નિર્ણયો અને વહીવટ માટે જરૂરી માહિતી એકદી કરવામાં અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે માહિતીસંચારનો ઉપયોગ થાય છે.
- (9) માનવીય પ્રક્રિયા : માહિતીસંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. માહિતીસંચારનાં માધ્યમો ગમે તે હોય પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતીસંચારનો અમલ થઈ શકતો નથી. માહિતીસંચાર કરતી વખતે ભય, લાગડી, કોષ વગેરે ઘણી બાબતો અસર કરે છે જેથી તે માનવીય પ્રવૃત્તિ છે.

માહિતીસંચારની પદ્ધતિઓ						
મૌખિક (Oral)	લેખિત (Written)	દશ્ય (Visual)	શાય (Audio)	દશ્ય-શાય (Audio-Visual)	મૌન (Silence)	
વાતચીત	વર્તમાનપત્રો	નકશા	ટેપરેકોર્ડ	ચલચિત્ર	મૂક સહમતિ	
વાર્તાલાપ	સામયિકો	ચિત્રો	રેડિયો	ટેલિવિઝન	મૂક અસહમતિ	
સંવાદ	ચોપાનિયાં	આકૃતિઓ	ટેલિફોન	ઇન્ટરનેટ	હાવભાવ	
ગોછી	જાહેર ખબર	આલેખ	ટેલિકોન્ફરન્સ	ક્રમ્યુટર્સ	(Body	
ભાષાણ	પત્ર લેખન	રંગો	વગેરે	વિડિયો-કેસેટ્સ	Language)	
જૂથ ચર્ચા	હસ્તલિખિત પ્રત	પ્રતીકો		વગેરે	વગેરે	
વગેરે	ઇ-મેઇલ	ચિનહો				
		વગેરે				

**6.6.3 વૈધિક અને અવૈધિક માહિતીસંચાર (Formal and Informal Communication) :** માહિતીસંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે.

(1) વૈધિક કે ઔપचારિક માહિતીસંચાર (2) અવૈધિક કે અનૌપચારિક માહિતીસંચાર

**(1) વૈધિક કે ઔપचારિક માહિતીસંચાર (Formal Communication) :** જે માહિતીસંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ-નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક કે ઔપचારિક માહિતીસંચાર કહે છે. આ માહિતીસંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે (વૈધિક રીતે) સંકળાયેલા હોય છે. તેનો ઉદ્દેશ અંકુશ અને સંકળનનો હોય છે. આ પ્રકારનો માહિતીસંચાર મહદું અંશે લેખિત સ્વરૂપ હોય છે. વૈધિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે. તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે. જે અંગેની વધુ સ્પષ્ટતા નીચેના ઉદાહરણ ઉપરથી થઈ શકે છે.

(i) અનિયમિત અને પૂર્વમંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણીરૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો.

(ii) કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર.

**લાક્ષણિકતાઓ :**

(1) આ માહિતીસંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે.

(2) ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકળનનો હોય છે.

(3) વૈધિક માહિતીસંચાર મહદુંઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે.

(4) આવા માહિતીસંચારનો સ્વીકાર વ્યવસ્થાતંત્રની એક નીતિ તરીકે થાય છે.

(5) વ્યવસ્થાતંત્રના માળખાને આધારિત હોય છે.

(6) વૈધિક માહિતીસંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરાય છે.

(7) સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે.

**(2) અવૈધિક કે અનૌપચારિક માહિતીસંચાર (Informal Communication) :** જે માહિતીસંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને ભિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતીસંચાર કહે છે. આ માહિતીસંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. જેમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી. તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે. અવૈધિક માહિતીસંચાર વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. દા. ત., કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે. સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતાં સેલ્સ પ્રેજન્ટેશન અંગેની માહિતી કે સૂચના સેલ્સમેનને આપે.

**લાક્ષણિકતાઓ :**

(1) માનવ સંબંધો ઉપર આધારિત હોય છે.

(2) અંકુશ કે આદેશની જરૂરિયાત હોતી નથી.

(3) મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે.

(4) માનવીય સંબંધો કે ભિત્રતા ઉપર આધારિત હોય છે.

(5) પરિવર્તનશીલ અને સરળ હોય છે.

(6) આ માહિતીસંચારમાં વિધિને કોઈ મહત્વ નથી.

(7) વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે.

(8) અવૈધિક માહિતીસંચાર એ વૈધિક માહિતીસંચારનો વિકલ્પ નહિ, પરંતુ પૂરક છે.

**6.6.4 વૈધિક અને અવૈધિક માહિતીસંચાર વચ્ચેનો તફાવત (Difference between Formal and Informal Communication) :**

ક્રમ	મુદ્દા	વૈધિક માહિતીસંચાર	અવૈધિક માહિતીસંચાર
(1)	અર્થ	જે માહિતીસંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ-નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક માહિતીસંચાર કહે છે.	જે માહિતીસંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતીસંચાર કહે છે.
(2)	ઉદ્દેશ	વૈધિક માહિતીસંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે.	અવૈધિક માહિતીસંચારનો ઉદ્દેશ વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનિયત પ્રદાન કરવાનો હોય છે.
(3)	આધાર	બે વ્યક્તિઓ વ્યવસ્થાતંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપલે કરે છે.	બે વ્યક્તિઓ અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપલે કરે છે.
(4)	અંકુશ અને દેખરેખ	અંકુશ અને દેખરેખની જરૂર રહે છે.	અંકુશ અને દેખરેખની જરૂર રહેતી નથી.
(5)	પરવર્તનશીલ	વૈધિક માહિતીસંચારની વ્યવસ્થા ખૂબ ઓછી પરિવર્તનશીલ છે.	અવૈધિક માહિતીસંચારની વ્યવસ્થા વધુ પરિવર્તનશીલ છે.
(6)	સમય	કાર્ય સ્થળે અને સમયે વૈધિક માહિતીસંચાર થાય છે.	ગમે તે સ્થળે; કાર્ય સમય સિવાય પણ અવૈધિક માહિતીસંચાર થાય છે.
(7)	અગાઉથી જાણ	માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે તેમજ માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે.	માહિતીનું સ્વરૂપ તેમજ વિધિ અગાઉથી નક્કી હોતાં નથી. સમય અને સંજોગો અનુસાર તે ઉદ્ભબે છે.

**6.6.5 અસરકારક માહિતીસંચારના અવરોધો (Barriers of Effective Communication) :**

માહિતીસંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. પરંતુ માહિતીસંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગડી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતીસંચાર વખતે અવરોધકો બને છે. આવા અવરોધો નીચે મુજબ છે.

(1) સ્પષ્ટ આયોજનનો અત્યાર : માહિતી મોકલતાં પહેલાં કઈ માહિતી કયા કમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે.

(2) ભાષાંતરની ભૂલો : મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય. આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચેલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતાઓ રહે છે.

(3) અસ્પષ્ટ સંદેશાઓ : માહિતીસંચારનાં વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. શર્જની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય છે. સંદેશાઓમાં એકસૂત્રતા હોતી નથી. પરિણામે આવા સંદેશાઓ માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતીસંચાર અવરોધાય છે.

(4) અસ્પષ્ટ અનુમાનો : ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે. આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે.

(5) યોગ્ય સમયનો અભાવ : કેટલીક વાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી ભવ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતીસંચારની અસરકારકતા ઘટે છે.

(6) માહિતીનું અતિ ભારણ : મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપ-લે થતી રહે છે. આવી આપ-લે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતીસંચારનો હેતું નિષ્ફળ નિવડે છે.

(7) સંદેશ પ્રત્યે દૂર્લક્ષ : કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશ પ્રત્યે બેધાન અને બેદરકાર રહે છે તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશ સાંભળવામાં દૂર્લક્ષ સેવવાથી માહિતીસંચારમાં અવરોધો ઉભા થાય છે.

(8) અયોગ્ય માધ્યમની પસંદગી : માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતીસંચારમાં અવરોધો ઉભા થાય છે.

(9) અવિશ્વાસ અને ડર : જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દસ્તિએ જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા ડરથી ઘણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેનાં માટાં પરિણામ સજી રૂપે ભોગવવાં પડ્યાં હતાં તેવાં અનુમાનો ને અનુભવોને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવામાં આવે છે.

#### 6.6.6 અવરોધો દૂર કરવાના ઉપાયો (Measures to Overcome the Barriers of Communication) :

- (1) માહિતી અવરોધાય નહિ તે રીતે વ્યવસ્થાતંત્રના માળખાને અનુરૂપ માહિતીસંચારના તત્ત્વને ગોઠવવું જોઈએ.
- (2) માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજ શકે.
- (3) માહિતી પ્રસારનાં જુદાં જુદાં માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ.
- (4) માહિતીસંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.
- (5) માહિતીસંચારમાં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે.
- (6) માહિતી પણોચાડવાનાં વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને તેટલી ટૂંકી હોવી જોઈએ જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અથવા માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય.
- (7) માહિતીસંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ.
- (8) માહિતીસંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ.
- (9) બિનજરી માહિતીનું પ્રસારણ માહિતીસંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ.
- (10) માહિતીસંચાર વ્યવસ્થાનું સમયાંતરે મૂલ્યાંકન થવું જોઈએ જેથી બદલાતા સંઝોગોને અનુરૂપ માહિતીસંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય.
- (11) માહિતીસંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દા. ત., માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે.

### દોરવણી :

**અર્થ :** દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો.

**લાક્ષણિકતાઓ :** (1) હેતુલક્ષી પ્રવૃત્તિ (2) સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય (3) સતત ચાલતી પ્રક્રિયા (4) પ્રવૃત્તિઓ પર દેખરેખ (5) વિશાળ કાર્યક્ષેત્ર (6) માહિતીસંચાર (7) પ્રોત્સાહન (8) નિભન્નગામી પ્રવૃત્તિ (9) સંચાલકીય કાર્ય.

**મહત્વ :** (1) કાર્યક્ષમતામાં વધારો (2) કાર્યક્ષમતાનું વિશ્લેષણ (3) કર્મચારીઓને પ્રોત્સાહન (4) અસરકારક આયોજન (5) અસરકારક વ્યવસ્થાતંત્ર (6) સંકલન અને સહકાર (7) અંકુશનું કાર્ય (8) કાર્ય જુસ્સામાં વધારો (9) વિચલનોની શોધ.

### દોરવણીનાં તત્ત્વો :

#### નિરીક્ષણ :

**અર્થ :** કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. ‘નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે.’ -શ્રી આર. સી. ડેવીસ

**નિરીક્ષકનાં કાર્યો :** (1) કાર્યનું આયોજન કરવું અને અવરોધો દૂર કરવા (2) કાર્ય સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન - દોરવણી આપવી (3) કાર્યોની સતત દેખરેખ રાખવી (4) વ્યક્તિગત ઉદ્દેશોને એકમના ઉદ્દેશો સાથે સાંકળવા (5) અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂર્ણ પાડવાં (6) જૂથ ભાવના ટકાવી રાખવી (7) માહિતીસંચાર ઝડપી બનાવવું (8) નવી ટેકનોલોજી વિષયક માર્ગદર્શન આપવું (9) શિસ્તની ભાવના ટકાવી રાખવી (10) અંકુશ નહીં પરંતુ કેળવણી પૂરી પાડે છે (11) મિત્ર-દાર્શનિક અને માર્ગદર્શક છે એ તરીકેનું કાર્ય.

#### અભિપ્રેરણ :

**અર્થ :** કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગ્ગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધ કરાવવી એટલે અભિપ્રેરણ.

**લાક્ષણિકતાઓ :** (1) આંતરિક પ્રેરણા છે (2) મનોવૈજ્ઞાનિક ઘ્યાલ (3) કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો (4) સતત પ્રક્રિયા (5) ફેરબદલી દરમાં ઘટાડો (6) ઉદ્દેશોની પ્રાપ્તિ (7) વિશાળ ક્ષેત્ર (8) પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ (9) સહયોગ પ્રાપ્તિ કરવાનું સાધન (10) હકારાત્મક અભિગમ (11) સંચાલનનું એક કાર્ય.

**માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ :** (1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો (2) સલામતીની જરૂરિયાતો (3) સામાજિક જરૂરિયાતો (4) સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો (5) આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો.

#### નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો :

**પ્રોત્સાહનો :** કર્મચારીઓને તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહન કહે છે.

**નાણાકીય પ્રોત્સાહનો :** (1) નફામાં ભાગ (2) સહભાગીદારી (3) બઢતી (4) બોન્સ (5) કમિશન (6) ઇનામો (7) સલાહ અને સૂચનો.

**બિનનાણાકીય પ્રોત્સાહનો :** (1) નોકરીની સલામતી (2) કામની કદર અને સન્માન (3) જવાબદારીની સૌંપણી (4) સલાહકાર (5) કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ (6) અન્ય પ્રોત્સાહનો.

## નેતૃત્વ :

અર્થ : કોઈ પણ ધ્યયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.

‘અન્ય વ્યક્તિઓમાં ધ્યય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ.’

લાક્ષણિકતાઓ : (1) તાબેદારોનું અસ્તિત્વ (2) સતત પ્રક્રિયા (3) નેતૃત્વનો સ્વીકાર (4) અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો (5) આદર્શ વ્યક્તિત્વ (6) અભિપ્રેરણ (7) હિતોની એકવાક્યતા (8) પરિસ્થિતિઓની અસર.

સારા નેતાના ગુણો : (1) શારીરિક ગુણો (2) બૌધિક ગુણો (3) માનસિક ગુણો.

## માહિતીસંચાર :

અર્થ : એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિના ઉદ્દેશ્યોને સમજી શકે અને તેઓ અમલ કરી શકે.

માહિતીસંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોનાં આદાન-પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે.

લાક્ષણિકતાઓ : (1) હેતુલક્ષી પ્રક્રિયા (2) શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવાં જોઈએ (3) દ્વિમાળી પ્રક્રિયા (4) કાયમી પ્રક્રિયા (5) અસંખ્ય સાધનો (6) અનેક પ્રકારો અને પદ્ધતિઓ (7) કાર્યપ્રેરક પ્રવૃત્તિ (8) વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ (9) માનવીય પ્રક્રિયા.

## વૈધિક કે ઔપચારિક માહિતીસંચાર :

અર્થ : જે માહિતીસંચાર ધ્યાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ-નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક કે ઔપચારિક માહિતીસંચાર કહે છે.

લાક્ષણિકતાઓ : (1) ઉપરી અધિકારી અને કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી વ્યવસ્થા (2) ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકળનનો હોય છે (3) મહૂદ અંશે લેખીત સ્વરૂપ (4) વ્યવસ્થાતંત્રની એક નીતિ તરીકે સ્વીકાર (5) વ્યવસ્થાતંત્રના માળખાને આધારિત (6) ધ્યાના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે તૈયાર કરાય છે (7) સમજવામાં સરળ અને સ્પષ્ટ.

## અવૈધિક કે અનૌપચારિક માહિતીસંચાર :

અર્થ : જે માહિતીસંચાર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઊપર આધારિત હોય તેને અવૈધિક માહિતીસંચાર કહે છે.

લાક્ષણિકતાઓ : (1) માનવ સંબંધો ઉપર આધારિત (2) અંકુશ-આદેશની જરૂરિયાત નહિ (3) મૌખિક કે સાંકેતિક ભાષાનો ઉપયોગ (4) માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત (5) પરિવર્તનશીલ અને સરળ (6) વિધિને કોઈ મહત્વ નથી (7) વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે (8) આ માહિતીસંચાર વૈધિક માહિતીસંચારનો વિકલ્પ નહિ, પરંતુ પૂર્તિ છે.

વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત : (1) અર્થ (2) ઉદ્દેશ (3) આધાર (4) અંકુશ અને દેખરેખ (5) પરિવર્તનશીલ (6) સમય (7) અગાઉથી જાડા.

અસરકારક માહિતીસંચારના અવરોધો : (1) સ્પષ્ટ આયોજનનો અભાવ (2) ભાષાંતરની ભૂલો (3) અસ્પષ્ટ સંદેશાઓ (4) અસ્પષ્ટ અનુમાનો (5) યોગ્ય સમયનો અભાવ (6) માહિતીનું અતિભારણ (7) સંદેશા પ્રત્યે દુર્લક્ષ (8) અયોગ્ય માધ્યમની પંસદગી (9) અવિશ્વાસ અને ડર.

**અવરોધો દૂર કરવાના ઉપાયો :** (1) માહિતી અવરોધાય નહિ તે રીતે વ્યવસ્થાતંત્રના માળખાને અનુરૂપ ગોઠવવું (2) માહિતી સમજ શકાય તેવી સ્પષ્ટ આપવી જોઈએ (3) માહિતી પ્રસારણના માધ્યમની યોગ્ય પસંદગી થઈ જોઈએ (4) ડિ-માર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ (5) બસે પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના આવશ્યક છે (6) માહિતી વહન રેખાઓ ટૂંકી હોવી જોઈએ જેથી માહિતીનો પ્રવાહ અટકી ન જાય કે પ્રસારણમાં વિલંબ ન થાય (7) માહિતીસંચાર વ્યવસ્થા જરૂરી હોવી જોઈએ (8) દેતુલક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ (9) પ્રસારણ યોગ્ય હોવું જોઈએ (10) સમયાંતરે માહિતીસંચાર વ્યવસ્થાનું મૂલ્યાંકન થુંબ જોઈએ (11) સમગ્ર પ્રક્રિયામાં માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ.

## સ્વાધ્યાય

### 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પંસદ કરી લખો.

- (1) દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે ?
 

(A) સલાહ	(B) અંકુશ	(C) દેખરેખ	(D) તાલીમ
----------	-----------	------------	-----------
- (2) દોરવણીની માત્રા કઈ સપાટીએ વધુ હોય છે ?
 

(A) તળ	(B) મધ્ય	(C) ઉચ્ચ	(D) દરેક સપાટીએ
--------	----------	----------	-----------------
- (3) દોરવણીના ક્યા તત્વમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે ?
 

(A) નિરીક્ષણ	(B) અભિપ્રેરણ	(C) નેતૃત્વ	(D) તાલીમ
--------------	---------------	-------------	-----------
- (4) પ્રોત્સાહન આપીને અપેક્ષિત ઘેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય ?
 

(A) અભિપ્રેરણ	(B) નિરીક્ષણ	(C) તાલીમ	(D) માર્ગદર્શન
---------------	--------------	-----------	----------------
- (5) માસ્લોની જરૂરિયાતોના અગ્રતાકમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે ?
 

(A) શારીરિક જરૂરિયાતો	(B) સલામતીની જરૂરિયાતો
(C) સામાજિક જરૂરિયાતો	(D) પ્રતિષ્ઠાની જરૂરિયાતો
- (6) નીચેમાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે ?
 

(A) બઢતી	(B) પ્રશંસા
(C) રોજગાર સલામતી	(D) કામની કદર અને સન્માન
- (7) નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે ?
 

(A) નિરીક્ષકો	(B) નિયોજકો	(C) તાબેદારો	(D) સંચાલકો.
---------------	-------------	--------------	--------------
- (8) એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું ?
 

(A) માહિતીસંચાર	(B) સંદેશા-વ્યવહાર	(C) કુરિયર-સેવા	(D) માહિતીપ્રેષણ
-----------------	--------------------	-----------------	------------------
- (9) તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી માકેલવાની પ્રક્રિયા એટલે શું ?
 

(A) માહિતીસંચાર	(B) માહિતીપ્રેષણ	(C) સંદેશા વ્યવહાર	(D) ટપાલ સેવા
-----------------	------------------	--------------------	---------------
- (10) અવૈધિક માહિતીસંચાર મોટા ભાગે ક્યા સ્વરૂપે થાય છે ?
 

(A) મૌખિક	(B) લેખિત
(C) લેખિત અને મૌખિક	(D) ઔપચારિક

**2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો :**

- (1) દોરવણીનો અર્થ આપો.
- (2) શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે ?
- (3) આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં કોણ મૂકે છે ?
- (4) નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આયું છે ?
- (5) માનવીની કઈ જરૂરિયાતો સૌથી વધુ અગ્રતાકમવાળી છે ?
- (6) નફા ભાગ એટલે શું ?
- (7) અવિશ્વાસ અને ડરથી માહિતીસંચાર ઉપર શું અસર થાય છે ?
- (8) આધુનિક માહિતીસંચારનાં સાધનો જણાવો.

**3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો :**

- (1) દોરવણીનાં તત્ત્વોની યાદી આપો.
- (2) નિરીક્ષણનો અર્થ આપો.
- (3) અભિપ્રેરણ એટલે શું ?
- (4) પ્રોત્સાહનનો અર્થ સમજાવો.
- (5) નેતૃત્વનો અર્થ આપો.
- (6) વૈધિક માહિતીસંચારની ટૂંકમાં સમજૂતી આપો.
- (7) 'નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે.' વિધાન સમજાવો.
- (8) અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે ?
- (9) સહભાગીદારી એટલે શું ?
- (10) અવૈધિક કે અનૌપચારિક માહિતીસંચાર એટલે શું ?

**4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો :**

- (1) દોરવણીનું મહત્વ જણાવો.
- (2) નિરીક્ષકનાં કાર્યો જણાવો.
- (3) સારા નેતાના ગુણો જણાવો.
- (4) અવૈધિક માહિતીસંચારની લાક્ષણિકતાઓ જણાવો.
- (5) વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત જણાવો.
- (6) માહિતીસંચારના અવરોધો દૂર કરવાના ગમે તે છ ઉપાયો જણાવો.

**5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો :**

- (1) દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.
- (2) અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.
- (3) માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાકમ આકૃતિ સહિત સમજાવો.
- (4) નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો.
- (5) માહિતીસંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- (6) માહિતીસંચારના અવરોધો સમજાવો.

